

DAG-1901300101040700 Seat No. _____

B. A. (Sem. IV) (WEF-2019) Examination

April - 2022

Geography: Paper - 8 (Core)

(Elements of Oceanograply)

(New Course)

Time	$e: 2\frac{1}{2}$ Hours]	[Total	Marks :	70		
સૂચના : (1) બધા પ્રશ્નો ફરજિયાત છે. (2) જરૂર જણાય ત્યાં સ્વચ્છ આકૃતિ દોરો.						
1	સમુદ્રશાસ્ત્ર એટલે શું ? તેનું કાર્યક્ષેત્ર વિગતે ચર્ચો. અથવા			14		
1	સાગરતળના ભૂપૃષ્ઠનું વિગતે વર્ણન કરો.			14		
2	પેસિફિક મહાસાગરના પ્રવાહો પર ભૌગોલિક નિબંધ લખો.			14		
2	અથવા સાગરજળની ક્ષારતા એટલે શું ? ક્ષારતાની વિવિધતાને અસ સમજાવો.	ર કરતાં	પરિબળો	14		
3	સમુદ્ર જળનું તાપમાન એટલે શું ? સમુદ્ર જળના તાપમાન ચ પર અસર કરતાં પરિબળોની ચર્ચા કરો.	મને તેના	વિતરણ	14		
3	અથવા સમુદ્ર મોજા એટલે શું ? તેના પ્રકારો વર્શવો.			14		
4	પરવાળાની શ્રેણીના વિકાસ માટેના ભૌગોલિક સંજોગો અને તેન્ અથવા	ના પ્રકારો	. જણાવો.	14		
4	દરિયાઈ ભરતી એટલે શું ? ભરતીના પ્રકારો જણાવી તેની સમજાવો.	ઉત્પતિનાં	કારણો	14		
5	ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) (1) સાગરજળનું બંધારણ (2) સમુદ્રના પ્રવાહોની અસરો (3) સમુદ્રો એ ભવિષ્યના સંસાધનના ભંડાર (4) સમુદ્ર નિક્ષેપો			14		

ENGLISH VERSION

1 What is Oceanography? Explain its subject matter in detail. OR 1 Describe in detail about the relief features of ocean. 2 Write a geographical essay on Pacific Ocean currents. OR 2 What is salinity of ocean water? Explain the factors affecting variation of salinity of ocean water. 3 What is Oceanic temperature? What are the factors responsible for distribution of Ocean temperature. OR 3 What are Ocean waves? Describe the types of it. 4 Which are the favorable geographical circumstances for development of coral reefs? Give information about its types. OR 4 What are tides? State the types of tides and explain the general idea about the origin of tides. 5 Write short notes: (Any Two) (1) Composition of sea water. (2) The effects of sea currents. (3) Ocean as store house of resource for the future. (4) Marine deposits.	Inst	ructions: (1) All questions are compulsory. (2) Draw neat diagram wherever necessary.	
Write a geographical essay on Pacific Ocean currents. OR What is salinity of ocean water? Explain the factors affecting variation of salinity of ocean water. What is Oceanic temperature? What are the factors responsible for distribution of Ocean temperature. OR What are Ocean waves? Describe the types of it. Which are the favorable geographical circumstances for development of coral reefs? Give information about its types. OR What are tides? State the types of tides and explain the general idea about the origin of tides. Write short notes: (Any Two) (1) Composition of sea water. (2) The effects of sea currents. (3) Ocean as store house of resource for the future.	1		14
OR What is salinity of ocean water? Explain the factors affecting variation of salinity of ocean water. What is Oceanic temperature? What are the factors responsible for distribution of Ocean temperature. OR What are Ocean waves? Describe the types of it. Which are the favorable geographical circumstances for development of coral reefs? Give information about its types. OR What are tides? State the types of tides and explain the general idea about the origin of tides. Write short notes: (Any Two) (1) Composition of sea water. (2) The effects of sea currents. (3) Ocean as store house of resource for the future.	1	Describe in detail about the relief features of ocean.	14
affecting variation of salinity of ocean water. What is Oceanic temperature? What are the factors responsible for distribution of Ocean temperature. OR What are Ocean waves? Describe the types of it. Which are the favorable geographical circumstances for development of coral reefs? Give information about its types. OR What are tides? State the types of tides and explain the general idea about the origin of tides. Write short notes: (Any Two) (1) Composition of sea water. (2) The effects of sea currents. (3) Ocean as store house of resource for the future.	2	· · · · · ·	14
responsible for distribution of Ocean temperature. OR What are Ocean waves? Describe the types of it. Which are the favorable geographical circumstances for development of coral reefs? Give information about its types. OR What are tides? State the types of tides and explain the general idea about the origin of tides. Write short notes: (Any Two) (1) Composition of sea water. (2) The effects of sea currents. (3) Ocean as store house of resource for the future.	2	· -	14
 What are Ocean waves? Describe the types of it. Which are the favorable geographical circumstances for development of coral reefs? Give information about its types. OR What are tides? State the types of tides and explain the general idea about the origin of tides. Write short notes: (Any Two) (1) Composition of sea water. (2) The effects of sea currents. (3) Ocean as store house of resource for the future. 	3	responsible for distribution of Ocean temperature.	14
for development of coral reefs? Give information about its types. OR What are tides? State the types of tides and explain the general idea about the origin of tides. Write short notes: (Any Two) (1) Composition of sea water. (2) The effects of sea currents. (3) Ocean as store house of resource for the future.	3	2	14
What are tides? State the types of tides and explain the general idea about the origin of tides. Write short notes: (Any Two) (1) Composition of sea water. (2) The effects of sea currents. (3) Ocean as store house of resource for the future.	4	for development of coral reefs? Give information about its	14
general idea about the origin of tides. 5 Write short notes: (Any Two) (1) Composition of sea water. (2) The effects of sea currents. (3) Ocean as store house of resource for the future.		OR	
 Composition of sea water. The effects of sea currents. Ocean as store house of resource for the future. 	4	What are tides? State the types of tides and explain the general idea about the origin of tides.	14
	5	 Composition of sea water. The effects of sea currents. Ocean as store house of resource for the future. 	14